



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલથાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/219

Dt. 23/11/2025

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

ચેમ્બર દ્વારા સ્કોબાના સહયોગથી સહકારી બેંકો માટે બેન્કીંગ કોન્કલેવ યોજાયો, સહકારી બેંકોના સમાવેશી વિકાસ પર મનોમંથન કટોકટીમાં પણ સહકારી બેંકોએ શાખ જાળવી રાખી છે : ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી વિકસિત ભારતમાં સહકારી બેંકો અગ્ર ભૂમિકા ભજવશે : સ્કોબાના અધ્યક્ષ ગૌતમ વ્યાસ ગુજરાતની સહકારી બેંકો સમગ્ર દેશ માટે રોલ મોડલ: આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર સતિષ મરાઠે

સહિયારી કોર બેન્કીંગ સિસ્ટમ ટૂંક સમયમાં જેમાં નાની બેંકો પણ જોડાઈ શકશે: એન.યુ.સી.એફ.ડી.સી. નવી દિલ્હીના સીઈઓ પ્રભાત ચતુર્વેદી

દરેક બેંક રિસ્ક ઓફિસર નીમે: NAFCUB ના વાઈસ પ્રેસિડેન્ટ મિલિંદ કાલે

સહકારી બેંકોનું છત્ર સંગઠન ઘણા પડકારો પર કામ કરી રહ્યું છે, બેન્કીંગ કોન્કલેવમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની શહેરી-ગ્રામીણ સહકારી બેંકોની ઉપસ્થિતિ

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધી સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક્સ એસોસિએશન લિમિટેડ (સ્કોબા)ના સહયોગથી શનિવાર, ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અવધ ઉટોપિયા, સુરત ખાતે બેન્કીંગ કોન્કલેવ- ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારી બેંકો માટે સર્વસમાવેશક વિકાસની થીમ પર કેન્દ્રિત આ કોન્કલેવમાં રાષ્ટ્રીય બેન્કીંગ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ અને સહકારી ક્ષેત્રના હિતધારકોએ ભારતની સહકારી બેન્કીંગ ઇકો સિસ્ટમમાં ઉભરતી તકો અને પડકારો અંગે ચર્ચા કરી હતી.

સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના આ કોન્કલેવને બે ભાગમાં વિભાજીત કરાયું હતું, જેમાં પ્રથમ ઉદ્ઘાટન સમારોહમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર શ્રી સતિષ મરાઠેએ નીતિગત સુધારાઓ, સહકારી નાણાંકીય વ્યવસ્થાને મજબૂત કરવા માટે આરબીઆઈના વિઝન અને ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં સર્વસમાવેશક વિકાસને ટેકો આપવા માટે સહકારી બેંકોની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

ટેકનિકલ સેશનમાં સહકારી બેંકોના નવા છત્ર સંગઠન એવા રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ (એન.યુ.સી.એફ.ડી.સી.), નવી દિલ્હીના સીઈઓ શ્રી પ્રભાત ચતુર્વેદીએ એન.યુ.સી.એફ.ડી.સી.ની પહેલ, ભવિષ્યના રોડમેપ અને સહકારી બેંકોને તેમની સેવાઓનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરવા માટે સક્ષમ બનાવવાના હેતુથી નવીનતમ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

NAFCUB (નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડ)ના વાઇસ પ્રેસિડેન્ટ અને કોસ્મોસ કો-ઓપ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન શ્રી મિલિંદ કાલેએ સહકારી બેંકિંગ ક્ષેત્રને મજબૂત કરવા માટે મજબૂત શાસન માળખા, ડિજિટલ પરિવર્તન અને જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે સહકારી ક્ષેત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું છે. આર્થિક કટોકટી આવી ત્યારે પણ સહકારી બેન્કોમાં બધી બેંકોને અસર ન થઈ. સહકારી બેન્કોએ તેમનું આગવું સ્થાન અને ગ્રાહકોનો વિશ્વાસ અને શાખ એવી રીતે જાળવી રાખ્યો છે કે આજે મોટી મોટી બેંકોએ ગ્રાહકો પાસે જવું પડે છે જ્યારે ગ્રાહક ખુદ સહકારી બેંક સુધી આવે છે. સરકાર પણ ઇચ્છે છે કે સહકારી બેંકો વૃદ્ધિ પામે.

સ્કોબાના અધ્યક્ષ શ્રી ગૌતમ વ્યાસે કહ્યું કે આપણે ત્યાં સહકારી બેંકોનો ખૂબ ભવ્ય ઇતિહાસ રહ્યો છે. ગઈકાલની સહકારી બેંકો અને આવતી કાલની સહકારી બેંકો વચ્ચે ટેકનોલોજી છે. એ ફેરફારોને આત્મસાત કરીએ, ૫ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી અને વિકસિત ભારતનાં વિઝનમાં સહકારી બેંકોની મહત્વની ભૂમિકા રહેવાની છે, આપણે સાથે મળીને એ તકનો લાભ લઈએ.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર શ્રી સતિષ મરાઠેએ કહ્યું કે ગુજરાતની બધી સહકારી બેંકો સમગ્ર દેશ માટે રોલ મોડલ છે. હું તો મેનેજમેન્ટ સંસ્થાઓને પણ કહું છું કે ગુજરાતની અર્બન સહકારી બેંકોના મોડલનો અભ્યાસ કરે. ચાલુ વર્ષના એડવાન્સ ડેટા મુજબ મેં નોંધ્યું છે કે સમગ્ર દેશમાં અર્બન કો.ઓ. બેંકોનું પ્રદર્શન છેલ્લા ૫ વર્ષમાં સૌથી સરસ છે. સહકારી બેંકો ખૂબ સરસ કામ કરી રહી છે, તેમણે પ્રચાર અને માર્કેટિંગ વધારવાની જરૂર છે.

દેશની અર્થવ્યવસ્થાનો ચિંતાર આપતા શ્રી મરાઠેએ કહ્યું કે, દાયકા પહેલા નાજુક પાંચમાં ગણાતું આપણું અર્થતંત્ર આજે ટોપ પાંચમાં છે, ત્રીજા ક્રમે આવવાની તૈયારી છે. મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને સેવા એમ ત્રણેય ક્ષેત્રો ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે. એસએમઈની સંખ્યા શહેરી અને ગ્રામીણ બંનેમાં સતત વધી રહી છે. સરકારે કૃષિ માટે પુશ આપીને એગ્રો પ્રોસેસિંગને પ્રોત્સાહન આપ્યું છે, દેશમાં વિકેન્દ્રીત વેરહાઉસનો વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ શરૂ થયો છે. બેંકિંગ ક્ષેત્ર આજે જે મજબૂતાઈએ છે એટલું પહેલાં ક્યારેય ન હતું. એનપીએ લેવલ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ કરતાં સારું છે. ફૂગાવો ઐતિહાસિક રીતે નિમ્ન છે. આમ બેન્કીંગ સેક્ટર ખાસ કરીને સહકારી બેંકો માટે વૃદ્ધિની ઘણી તકો અને અનુકૂળ વાતાવરણ છે. દરેક બેંક વૃદ્ધિ માટે વિઝન ડોક્યુમેન્ટ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે સહકારી બેંકોએ સારી રીતે મૂડી સંપત્તિ રહેવાની જરૂર છે. કોવિડ પછી આરબીઆઈએ તમામ બેંકોને મૂડી વધારવા કહ્યું હતું.

સહકારી બેંકો પોતીકી મિલકતની ચિંતા કરે છે એમ ટેકનોલોજી પાછળ ખર્ચ

શ્રી મરાઠેએ કહ્યું કે આજે બેંકિંગ વધારે જટિલ બન્યું છે. ટેકનોલોજી માટે જોઈએ એટલું કામ હજી થયું નથી તે ચિંતાનો વિષય છે. સહકારી બેંકોનું બોર્ડ બ્રાન્ચ પોતીકી મિલકતમાં હોય એની ચિંતા કરે છે, એ સારું પણ છે પણ સાથે ટેકનોલોજી પાછળ પણ ખર્ચ કરે તો વધુ સ્પર્ધાત્મક બનશે.

ત્યારબાદ ટેકનિકલ સેશનની શરૂઆતમાં શ્રી પ્રભાત ચતુર્વેદીનો પરિચય શ્રી દેવેન ચોકસીએ આપ્યો હતો. શ્રી ચતુર્વેદીએ કહ્યું કે સહકારી બેંકો માટે મુખ્ય પડકાર ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને ખર્ચનો છે. આ માટે છત્ર સંસ્થા એન.યુ.સી.એફ.ડી.સી ઘણી બધી પહેલ કરી રહ્યું છે. લોન માટે પોલિસી બજાર જેવું પ્લેટફોર્મ હોવું જોઈએ, ઝીરોધા અને ગ્રો જેવી ઓનલાઈન ટ્રેડિંગ એપમાં સહકારી બેંકો સામેલ થવી જોઈએ. તેમણે કહ્યું કે ઘટતી થાપણો જેવા પડકારો પણ છે. તેમણે એસએમઈ માટે ઇનોવેટિવ કરન્ટ એકાઉન્ટ, સગીરો માટેની પ્રોડક્ટસ, યુપીઆઈ ચાર્જ બેંકો માટે ઘટે એ માટેનાં પગલાં વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં છે એવી સહિયારી કોર બેંકિંગ સિસ્ટમ નજીકના ભવિષ્યમાં શરૂ થશે જેમાં નાની બેંકો પણ જોડાઈ શકે.

શ્રી મિલિંદ કાલેએ કહ્યું કે આરબીઆઈએ ૫૦૦૦ કરોડથી વધુના લોન પોર્ટફોલિયો માટે રિસ્ક ઓફિસર ફરજિયાત કર્યું છે પણ મને લાગે છે કે દરેક બેંકે રિસ્ક ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. તેમણે આ સંદર્ભમાં ૨૦૧૮માં કોસ્મોસ બેંકે સાયબર એટેકમાં કેવી રીતે ૮૪ કરોડ રૂપિયા ગુમાવ્યા એનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ઈરાદાઓ સાચા હોય તેમ છતાં દરેક નિર્ણયમાં જોખમ રહેલું છે, આથી સહકારી બેંકોએ ગ્રોથની સાથે રિસ્ક મેનેજમેન્ટ અપનાવવું પડશે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ સમગ્ર કોન્કલેવની માહિતી આપતા કહ્યું કે સહકારી બેંકો માટે પહેલીવાર આ કોન્કલેવ થઈ રહ્યો છે. તેનો હેતુ નીતિ ઘડનારા, નિયામકો વચ્ચે સહયોગ વધારીને, જોખમ વ્યવસ્થાપન દ્વારા ક્ષમતા વિસ્તારીને સહકારી બેંકોને સમાવેશી વિકાસ માટે સુયોજિત બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં સહકારી બેંકો વિકસિત ભારત માટે ખૂબ મહત્વની ભૂમિકા અદા કરશે.

ચેમ્બરના માનદ્ જાનચી શ્રી મિતિષભાઈ મોદીએ મુખ્ય વક્તા શ્રી સતીષ મરાઠેનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી રોહિત મહેતા સમગ્ર કોન્કલેવનું સંચાલન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં આભારવિધિ આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક સુરત પીપલ્સ કો. ઓ. બેંકના ચેરમેન અમિત ગજજરે કરી હતી.

સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સ્કોબાના સેકન્ડ વાઈસ ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળાએ કરતા કહ્યું કે ભારત બદલાઈ રહ્યું છે એની સાથે બેંકિંગ ક્ષેત્ર પણ બદલાઈ રહ્યું છે.

આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના ડિરેક્ટર્સ, હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રસપ્રદ પ્રશ્નોત્તરીમાં વક્તાઓએ સહકારી બેંકર્સના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.